

Arfin India Limited

September 26, 2024

To

BSE Limited

Corporate Relation Department Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400001, Maharashtra, India. **Scrip Code** : 539151

Security Id: ARFIN ISIN: INE784R01023

Subject:

Newspaper advertisement and notice to shareholders under the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer

and Refund) Rules, 2016

Dear Sir,

Pursuant to the provisions of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are forwarding herewith the copies of the newspaper advertisement published in the newspapers, Economic Times English and Navgujarat Gujarati dated Thursday, September 26, 2024 titled "TRANSFER OF EQUITY SHARES TO THE INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)".

We are also enclosing herewith copy of sample letter simultaneously dispatched to the concerned shareholders, titled "Transfer of shares in respect of which dividend has not been claimed for seven consecutive years or more to the investor education and protection fund".

Kindly take the same on your record.

Thanking you,

For, Arfin India Limit

Mahendra R. Shah

Chairman

DIN:00182746

Encl.: Copies of newspaper notices and sample letter dispatched to concerned shareholder(s)

Registered & Corporate Office:

Plot No. 117, Ravi Industrial Estate,

B/h. Hotel Prestige, Billeshwarpura, Chhatral,

Tal. - Kalol, Dist. - Gandhinagar - 382729, Gujarat, India.

Ph.: +91-2764-232621 Fax: +91-2764-232620

Email: info@arfin.co.in

CIN No.: L65990GJ1992PLC017460

Plant / Factory:

Plot No. 118 / 1,2,3 & 117 / 3,6,7, Ravi Industrial Estate, B/h. Hotel Prestige, Billeshwarpura, Chhatral,

Tal. - Kalol, Dist. - Gandhinagar - 382729, Gujarat, India.

Ph.: +91-2764-232620 Fax: +91-2764-232620

Zetwerk Mfg Bags NTPC Deal worth ₹2,500 crore

Kalpana Pathak

Kalpana Pathak

Mumbai: Contract manufacturing company Zetwerk Manufacturing on Wednesday said it has won a 1,155 MWp (megawatt peak) order from NTPC for production and supply of ALIM-Compliant solar photovoltaic (PV) modules: This will include mandawide. This will include mandawide. This will include mandawide the solar photovoltaic (PV) modules: This will be mandawide the solar project in Gujarat. Bengaluru-based Zetwerk did not disclose the order value. Ho environmental countries of the solar proportion of the solar power of

Dopamine Does Not Cause Placebo Effect. finds Study

New Dalhi: The placebo effect, or experiencing pain relief by experiencing pain relief by experiencing pain relief by the placebo experiencing pain relief by the placebo effect according to a study. Previous studies have suggested that dopamine-based reward and learning processes contribute to the placebo effect.

However, researchers from the University Hospital Essen, relief of dopamine in initially producing a placebo effect, and thereafter maintaining it, was unknown.—PTI

AGENCY HAD FROZEN SOME ESOPS EARLIER

ED Lens on More **Esops of Saluja, Religare Officials**

Probe into Esops meant to ascertain whether any illegality was

committed, says official

Raghav Ohri

Raghav Ohri

New Delhi: Probing the alleged laundering of monies in the Religare scandal, the Enforcement Directorate (ED) is scrutinising employee stock options (Esop) issued to Religare candother scrutinising employee stock options (Esop) issued to Religare candother officials stock of the scrutinising employee stock options (Esop) as and other officials at lower prices for "any illegality", a senior official said. The federal agency had last month frozen Esop shares of Saluja and other officials worth (72)-54 crore, alleging that they made unlawful gains of that much by diverting Religare Enterprises' funds to subscribe to rights issues of Care Fieath Insuranterial and the state of the state of

Case File ED probing for "any illegality" in allotment of more Esops

₹179.54 cr Esop shares frozen of Religare executive



ses that led to the delay, as well as the company's actions regarding share allotments and Employee Stock Ownership Plans (Esops). Sadiula has repeatedly denied all charges levelled against her and maintained that all the Esops awarded to her and other of-

the Esspa swarded to her and other of ficials of REL are "as per the compa-ny policies". She has reportedly said the Esspa have been given only in-centrive all the employees. In a related development, the Mum-bai Police have got the statement of Valbhav Gowli, an REL shareholder, very development, the compa-tion of the companion of the companion of the CPP before a guide clark and the companion of the CPP before a guide clark and the companion of the inthe know.

CrPC before a judicial magistrate (ad-missible in a court of law), said people in the know. The police had registered the FIR against Saluja and others based on a complaint given by ED after the agen-cy recorded Gawli's statement under Section 50 of the Prevention of Mo-ney Laundering Act (PMI.A.), which is also admissible in acourt.

BP Global CEO Sees 'Growing' **India Business Opportunities**



New Delhi: Energy firm BP sees growing business opportunities" in India, its global chief executive Murray Auchincloss said in a sta-

Murray Auchincloss said in a statement on Wenkesday. The board of London-headquartered BP is holding a meeting in India this week, said a company statement. This is the second time BP's board is meeting in India. The first meeting was held in 2013, about two years after company took a 30% interest in Indian upstream projects managed by Reliance India to the statement of the said of the s

AIMS TO SETTLE ITS REMAINING DEBT IN THE NEXT OUARTER

Reliance Power Arm Prepays ₹850-cr Debt to S'pore Co

Co says strengthening of Rosa Power's balance sheet to support promoter firm **Funding Route**

Reliance Power recently said it has become debt-free

1,200 MW

Our Bureau

Mumbai: Rosa Power, as sprepaid
₹850 crore of its deb to Singaporebased lender Varde Partners.
Anil Ambani-owned Reliance Power had recently announced that
it has become debt-free.
"Following Reliance Power's
achievement of zero debt, Rosa Power is now on track to become
debt-free," the company said on
wednesday adding it aims to settle
its remaining debt in the next quaarter, completing the process before the end of the current financial
year:

year: Rosa Power, which operates a 1,200 MW coal-based thermal power plant in Rosa village near Shahahapur, Utar Pradesh, has Varde Partners as its sole lender. "The strengthening of Rosa Power's balance sheet, along with a crecent 15,25 croe preferential issue, will support Reliance Power in exploring new business opportunities, particularly in the rene-

wable energy sector," the company said.

On Monday Reliance Power's board approved the preferential issue, with over 7600 crore commany. Reliance Infrastructure, and the remaining 7900 crore from Authum Investment and Infrastructure in the stability of through investments in Infrastructure in the stability of the preferential Issue is expected.

This preferential issue is expected.

Varde Partners is its sole lender

₹1,525 Cr

Proceeds to help expand business

GR Infraprojects Plans to Raise \$200 m to Fund Power Projects

Kalpana Pathak

Kalpana Pathak

Mumbai: Infrastructure company
GR Infraprojects has mandated
Standard Chartered Bank to raise
15.00 core (S200 million) equity capital, according to sources close to
the development. Proceeds from
the fundraise will be used to fund
greenfield transmission projects
for the power sector. GR Infraprojects, which has traditionally been
engaged in roadways and highway
projects, has diversified into the power transmission development
space ower the past few years.
"As India plans to achieve 500 GW
of renewable energy capacity by
2030, integrating such large-scale

renewable energy into the grid will need a future-ready transmission system. GR Infraproject's fundraise will facilitate the company's expan-sion in this segment," said an in-dustry official aware of the fundrai-

dustry on inclaiments.
The company has a market cap of ti6,147 crore. In the last year, its scrip has seen gains of 33% while the Sensex is up 29%.
GR Infraprojects and Standard Chartered Bank did not reply to an email query.

email query.

As part of its expansion strategy, earlier this month, GR Infraprojects acquired Tumkur-II REZ Power Transmission, a special purpose vehicle of REC Power Development and Consultancy for 86.7 cro-

re. The Tumkur-II REZ Power Transmission project involves the establishment of a 400/20 kt. 48500 MVA pooling station near Tumkur in Karnataka, along with a 27.2 km 400 kV transmission line and associated infrastructure, at a cost of around 73% crore, slated to be completed within 24 months. The project is part of a broader in-taitwe aimed at transmitting 77 GW

The project is year to a string in the trained and transmitting 17 GW of renewable energy from Karnataka.

As per the Central Electricity Authority, the integration of additional wind and solar capacity by 2030 has been estimated as 50,890 2030 has been estimated as 50,890 ckm and 4,33,575 MVA respectively, at an estimated cost of Rs 2,44,200 crores.

OFFICE OF THE EXECUTIVE ENGINEER ORD, ROAD DIVISION, JAMSHEDPUR, JHARKHAND

Very Short e-Procurement Notice
For National Competitive Bidding
Very Short e-Tender Reference No. RCD/JAMSHEDPUR/1674
Date-24.09.2024

1.	Name of the work	Construction of Nine (09) Numbers of H.L. Bridges at Different Chainages of Kowali- Dumaria Road for the year 2024-25
2.	Estimated Cost of Work (in INR)	Rs 16,11,88,244.47 (Rupees Sixteen Crore Eleven Lakh Eighty Eight Thousand Two Hundred Forty Four & Forty Seven Paisa Only)
3.	Initial Bid Security (Rs In Lacs)	Rs 16.12 Lakh (Rupees Sixteen Lakh Twelve Thousand only).
4.	Initial Bid Security in the shape of	Initial Bid Security - As per SOP issued by Information Technology and e-Governance Department, Govt. of Jharkhand vide Letter No. 120, Dt. 03.10.2023
5.	Cost of Bidding documents	Rs 10,000.00 (Rs Ten Thousand) only.
6.	Time of Completion	18 (Eighteen Months)
7.	Date of Publication of Tender on website	26.09.2024 at 12.30 P.M.
8.	Start date of bidding	26.09.2024 from 12.30 P.M.
9.	Last date & Time for online bidding	04.10.2024 up to 02.00 PM.
10.	Type of Bid	Two envelope mode (Technical and Financial Bid)
11.	Last date & time for receipt of Bid Security and other documents in Online form	04.10.2024 Through e-tendering portal www.jharkhandienders.gov.in As per SOP issued by Information Technology and e-Governance Department, Govt. of Jharkhand vide Letter No.120, Dt. 03.10.2023
12.	Date & time for opening of Technical Bid	05.10.2024 at 3.00 PM by e-Procurement Cell, Room No. 330A, 3 rd floor, Road Construction Department, Jharkhand Mantralaya, Dhurwa, Ranchi
13.	Name & address of office Inviting tender	Executive Engineer, RCD, Road Division, Jamshedpur, Road No 1, CH Area.
14.	Contact no. of Procurement officer	0657-2227724
15.	Helpline number of e- Procurement cell	0651-2401010

PR 337047 Road (24-25)_D Executive Engineer RCD, Road Division, Jamsheda



ARFIN INDIA LIMITED

906J1992PLC017460, Contact: +91 2764 232621

RANSFER OF EQUITY SHARES TO THE INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)

EDUCATION AND PROTECTION FUND (IEEE)*
Membes are hereby informated that in terms of Section 124 of the Companies Act.
2013 and IEEF Rules; 2016, as amended, equity shares of the company, in respect
of which dividend entitlements have remained unabland or unput for seven
consecubly eaps as more, an enquale to be transferred by the company to the
investor education and protection hard (IEEF) of the Commanies of Manch
Lockimiden of Unpublic Michined for the financial year ended on March 2, 2017 is
presently with this bocompany at in in terms unity to claim such sidered for
the financial year ended on March 31, 2017 and onwards by sending a lefter under
their signature so as to reach at the neglected office of the company or RTA. MICS
SYAHET REANSFER ACHI LUTHIED at 101, Shattali Complex, Ogo, Bita Show
Room, Ashram Road, Ahmediated -390009, Quijant, India on or before October 17,
2024. The details via, cames of the occomend entembre, their loin number or DPI III
— Client ID and the shares for transfer to the IEPF are available on the company
whiston eyes wards. cames of the occomend entembre, and the incurrent of
the IEPF by the company, such shares may be claimed by the concerned
nembers only them the IEPF authority by following the procedure rescribed under
the IEPF by the company, such shares may be claimed by the concerned
members only them the IEPF authority by following the procedure rescribed under
the IEPF Rules.

the EFF Alies.

The Shareholers may furn one that the details of unclaimed dividends and shares of the concenned shareholders) uploaded by the company on its website www.actim.co.iii. shall be treated as adequate notice in respect of issue of the new share certificately by the company for the purpose of transler of shares to EFF pursuant to the Rales. Please note that no claim shall is against the company in respect durinclaimed dividend and equity shares transferred of the TeF.

Individual letters in this registered actions when the time company in respect durinclaimed dividend and equity shares transferred to the EFF.

Individual letters in this registered addresses available with the company in sending email at messtahandridgemall.com or by calling them at +91 73-2650461, 762 / 83. This notice is published pursuant to the provisions of EFF Rales. 2014.

Place: Chhatral Date: September 26, 2024

For Arfin India Limited Mahendra R. Shah - Sd/-lan & WTD DIN: 00182746)

COCHIN INTERNATIONAL AIRPORT LTD. **TENDER NOTICE** 26.09.2024

lo	Tender No	Name of Work	Amount	EMD	Period
1	CIAL/ELE/384	SITC of Street Lighting along the Airport Service Road	Rs.31.7 lakhs	Rs.75,000/-	04 Months
2	CIAL/ELE/10	Cable re-routing and RMU replacement at CIAL	Rs.41 Lakhs	Rs.1,00,000/-	04 Months

For more details, visit our website www.cial.aero

IN THE HON'BLE HIGH COURT OF M.P., INDORE BENCH
ORIGINAL JURISDICTION
IN THE MATTER OF THE COMPANIES ACT, 1956
IN THE MATTER OF:MIS. CHIRAG METAL ROLLING MILLS PYIL LTD (IN-LIQN.)
COMPANY PETITION IN.O. 11/1999
e-AUCTION SALE NOTICE
USBERIAL IN DISCORDER SEARCH OF A MODIFIED

TO SEARCH AND THE CONTROL OF THE METAL THE CONTROL OF THE METAL THE CONTROL OF THE METAL THE META

Pursuant to the orders dated 92/09/2024 of the Horble High Court of M.P. Indore Banch, e-Tenders are invited in respect of sale of the following assets/ properties of the company (In-Lion,) or "AS IS WHEEL IS AND WHATSOEVER THERE IS BASIS" from the prospective buvers:

Land:—Leasehold right of Land admeasuring 9754.90 Sq. mtr. situated a Plot no. 20, Sector III, Industrial Area, Sagore Pithampur Dist, Dhar (M.P). The detail of Reserve Price and FMD are as under:-

Sr. No.	Description of Assets	Reserve Price (Rs)	EMD (Rs)
1.	Land:— Leasehold right of Land admeasuring 9754.90 Sq. mtr. situated at Plot no.20, Sector III, Industrial Area, Sagore Pithampur Diet Dhar (M.P.)	Medicition.	68,28,400/-

te:inspection of the all assets/properties, will be held on 08/10/2024 between 11:00 A.M.
to 4:00 P.M. At the time of taking inspection of the aforesaid assets/properties of the
company (In- Upn.), all the interested buyers are requested to follow the advisory
issued by the District Administration in the interest of their own well-being and in public

company (in Call'), a in interested buyer an explosed of book on a whorey interests.

In order to participate in on-line a-studion, tenderers have to pay a non-etimable e-acution, participate in on-line a-studion, tenderers have to pay a non-etimable of "a-duction of Assets by the Official Liquidator" Current Account No. 07/2020/2002/789 Purpla National Bards, Silemans Bazza Fennich, Indone, Bandlor Code-07/2000 (TOS) NETF IT'S Code PUNBO02/700 and same may be made by The Indender should submit their online offer. Brough the website-https://labauction.en/vida.com.

The Intenders should submit their online offer. Brough the website-https://labauction.en/vida.com. and get user ID and Password and get training on e-acution from Mis Rail ICl Corporation (India LL Customer Care number of e-Nixol Tayan-84/20099). Sh. Akstah Kumar-085/5008/46, Sh. Sitesh Taragan-84/200999. Sh. Awarea Marsha -Baldso036093, Sh. Ammenta Kumar-085/5008/46, Sh. Sitesh Taragan-84/200999. Sh. Awarea Marsha -Baldso036093, Sh. Ammenta Kumar-085/5008/46, Sh. Sitesh Taragan-84/200999. Sh. Awarea Marsha -Baldso036093, Sh. Ammenta Kumar-085/5008/46, Sh. Sitesh Taragan-94/46/18, Tara

concluded. This Sale is subject to confirmation by the Hon'ble High Court of M.P., Indore Bench. This Sale Notice be treated as notice to the secured creditors / unsecured creditor contributories, Central & State Government authorities/bodies and all other parti

International Control of the Control

by them be right Court. United Liquidous anymen. Sair.

Sair. 25/09/2024 (VYOMESH SHETH, ICLS)
Place: (NDORE (M.P.) OFFICIAL LIQUIDATOR
Phone: 0731-2710051 HIGH COURT of MADHYA PRADESH, INDORE (M.P.)
1ST FLOOR, OLD CIA BUILDING, OPP GPO, RESIDENCY AREA, INDORE (M.P.)

स्थान जिल्हा होता है। त्यार हो हुए होता हो है। है जिल्हा है जो ने वादिया के तथा वे वादिया के हिंदी स्थान विदेश है में महार है http://eproc.orgiasthan.gov.in, http://eppp.rajasthan.nic.in हैयां da.rajasthan.gov.intrate पर देवा का सम्बत्ती है। इश्वरूप स्विद्धां को अपने हित्रिकट हताहर के माध्यम के http://eproc.rajasthan.gov.intrate पर विस्टाई के पार्चा आवरण के हैं।

IN THE HON'BLE HIGH COURT OF M.P., INDORE BENCH ORIGINAL JURISDICTION
IN THE MATTER OF THE COMPANIES ACT, 1956 IN THE MATTER OF: - M/S. MAIKAAL FIBRES LTD. (IN.LIQN.)

e- AUCTION SALE NOTICE

Pursuant to the order saled 21/08/2024 of the Horbite High Court of M.P. Indow Bench, e-Tenders are invited in respect of sale of the following assets/properties of the company (In-Linq.) on "AS IS WHERE IS AND WHATSOEVER THERE IS BASIS" from the prospective buyers:

LON 0.1- Land-T-reehold Industrial Land admeasuring 2.833 Hectares situated at Khasar No.2166 Patwart halks no.6, Gram Parchayst Douglegaon, Margone main road, Fleis-Massrawo, Dats Khatsprom Congregaon, Margone main road, Fleis-Massrawo, Dats Khatsprom company (Insil-Massrawo, Dats Khatsprom company) (Insil-Massrawo, Dats Khatsprom company) (Insil-Massrawo, Dats Khatsprom Congregaon, Margone main road, Fleis-Massrawo, Dats Khatsprom Congregaon, Margone main road, Sale Sale Sale Codown, Store & Rest roam, Tollet Block, Store, Officel Staff Clauriers with toilet, Open well Pucca, UG WT, Septic Tank, Boundarywall.

Jundary wall.

b No. 2- Plant, Machineries and other assets: - Plant & Machineries:
ouble Roller Gimning Machine (supplier KK Engineering, Ahmedabad),
nos., Seed Screw Conveyor: 1 no., Double roller cotton grinting
ones, for the plant of the plant of the plant of the plant
extricals Panel Board, MS Plate (covering screw conveyor) - 80 no., MS
act - 1 no., Galte - 2 no. Etc. and other assets.

Lot No.	Description of Assets	Reserve Price (Rs)	EMD (Rs)
Lot No. 1	Land & Building	3,53,90,700/-	35,39,070/-
Lot No. 2	Plant & Machinery and other assets	6,13,800/	61,380/-
Lot No. 3	Composite Lot (182)	3 60 04 500/-	36 00 450/-

882: Inspection of the all assets/properties, will be held on 03/10/2024 between 11:00 A.M. to 4:00 P.M. At the time of taking inspection of the aforesaid assets/properties of the company (In-Live), at the interested buyers are requested to follow the advisors issued by the District Administration in the interest of their own well-being and in public interest.

weekend by the District/Aministration in the interest of their own well-being and in public interest. To paticipate in in-the exaction, interests with the paticipate in in-their exaction, interests with the paticipate in in-their exaction, interests when the paticipate in in-their exaction, interests when the page (see this exaction participation fies of the 1000+ (Ropues Otto thousand only) in the account of "e-Auction participation fies of the 1000+ (Ropues Otto thousand only) in the 2012/002/002/1959, Punjan National Bank, Sitlamas Bazze Branch, Indoor, Branch Code-12100, RTOSN INETT/IFS Code (PullBoOtt2200 and same may be made by 10.10.2024 till 06.00 PM.

The bandwarts abouted submit their online offer Brough the website-integrational control of the patients of the p

https://olauction.en/vida.com.
The intending purchasers/bidders are required to register their name at hispitalization. The intending purchasers/bidders are required to register their name at hispitalization and the programment of the progra

India Ltd. from successful bildder.

The EMD amourt (interest free) should be deposited by way of NEFT/RTGS in the account of "e-Auction of Assets by the Official cujudator", Current Account No. 2012/02/102/02/03/99, Purpla National Bank, Sitiamista Baser Branch, Indered 2012/02/102/02/03/99, Purpla National Bank, Sitiamista Baser Branch, Indered 2012/02/02/02/03/99, Purpla National Bank, Sitiamista Baser Branch, Indered 1019/02/03/03/99, Purpla National Bank Sitiamista Baser Branch, Indered 1019/02/03/03/99, Purpla National Bank Sitiamista Bank Sitiam

The e-auction will be conducted through the website https://olauctior on 17/10/2024 between 1.00P.M to 3.00 P.M. with auto time extension each time if the bid is made in the Last minutes before close of e-auc orify will be given to the tenderers purchasing Composite Lot. no.3 (All assignments of Lot 1 & 2)

Priority will be given to the tenderers purchasing Composite Lot. no. 3 (All assets and properies of Lot. 11 42 and hyp the risch help light court field.)

This Sale is subject to confirmation from the light court of the P. Noticer Bench. This confirmation is the second contion of unincurred conditions of the confirmation of the light court of the light

Sd/(VYOMESH SHETH, ICLS)
OFFICIAL LIQUIDATOR

OFFICE OF THE OFFICIAL LIQUIDATOR

"I" Floor, Carporate Bhawan", Bandiaguda, Nagoie, Hyderabad — 500 068.

Ph. No.849-62308081 7186, Email: chlydreabadigmca, govin

In the matter of Mis. Shi Vidinzeniya Industries: Limited (in Liquidation)

Notice for sale of sasts through s-auction

CORRIGENDUM

With reference to Sale Notice of this office published on 24-92-2024 in "The

Economic Times", the "Incremental Bild amount" has not been printe and kept as

buther in the table part of The datalise of Asatsh, Reserve Price, EMD and

Rs. 2.001847 and hence the "Incremental Bild amount" will be read as

Datic 24-9-9224 (UK. Sal4Oo, CLS)

Place Hyderabad

HIGH COURT OF TELANGANA AND ANDRHA PRADESH, HYDERABAD

HIGH COURT OF TELANGANA AND ANDRHA PRADESH, HYDERABAD

In the HON'BLE High Court of M.P., Indore Bench ORIGINAL JURISDICTION
IN THE MATTER OF THE COMPANIES ACT, 1956
In the matter of M/s. Al-Fahad Investment Ltd. (IN-LIQN.)

Company Petition No. 13/2003 e- AUCTION SALE NOTICE

tenders are invited in respect of sale of the following assets/proporties of the compara-n-Lign.) on "AS IS WHERE IS AND WHATSOEVER THERE IS BASIS" from the ospective buyers:

e obyers:-old right of Shop No.32 having Built up area 15.95 SQM, situated at Block N opping Complex, Sector no.29, Noida (U.P) upto 07/11/2086.

S.	Description of Assets	Reserve Price	EMD
no.		(Amount in Rs.)	(Amount in Rs.)
	Leasehold right of Shop No.32 having Built up area 15.95 SQM. situated at Block No.4, Ganga Shopping Complex, Sector no.29,	35,09,000/-	3,50,900/-

obsc:
Inspection of all the assets/properties, will be held on 09/10/2024 between 11:30 A.M. to 4:00 P.M. At the time of taking inspection of the aforesaid assets/properties of the company (in: Lan), all the interested buyers are requested to follow the advisory issued by the District Administration of the area in the interest of their own elbelloging and public interests.

In order to participate in on-line a-auction, tenderers have to pay a non-returnable a-auction participation feet 681, 1000/(Rupes One thousand only) in the account of "a-Auction of Assets by the Official Lquidstor", Current Account No. 02/10/20/10/2099 Unityle Netions Bellin Stillarnab asset frament, indoor, No. 02/10/20/10/2099 Unityle Netions Bellin Stillarnab asset frament, indoor, but the control of t

Integrational Confirmation. The Intending processor are required to register their name a https://louciton.envida.com.and.get.user/ D.and Password and get training or e-wutchn from Mrs Raffel Copporation of India Ltd. Customer Care number e-Nivida Team --91-11-4960960, Sh. Askash Kumar-3955030614, Sh. Sised rangara-844228899, Sh. Namesh Mishra-M-8355030630, Sh. Amrendra Kuma —NI-8448288990, Sh. Abhash Mrs Mrs Sh. Sised Sh. Sised Al-8448288990, Sh. Abhash Mrs Mrs Sh. Sised Sh. Sised Team of Sh. Sised Mrs Sh. Sised Sh. Sised Sh. Sised Sh. Sised Mrs Sh. Sised Mrs

—M-844(28989), 5h. Abhishok Kumar-M-9350005(7).

After successful cauction, a fixed amount of Ra 25,000-will be charged by auction agency-Mis RailFall Corporation of India 1th from successful bidder.

The EMD amount (interest free) should be deposited by way of NET-FIRCS is the account of "e-Auction of Assets by the Official Liquidator", Gurrer Account No. 2012001002/1899, purplya National Bank, Stilamata Baza Branch, Indore, Branch Code-021200, RTGS/INEFT/IFS Cod PURB0021200. The last date for swinsters or of online offer along with EMI tender few with supportive documents is 16/10/2024 fill 06.00 PM.

The official Liquidator shall not be held responsible for the problem of intern-connectivity, network problem, system crash down, power failure, access issu-and such reason.

Bench.

The Sale Notice be treated as notice to the secured creditors/unsecured creditors/unsecured-unsecu

Official Liquidator in this regard in future.

The other details of above e-auction along with terms and co available in the website https://olauction.enivida.com.

available in the website https://olauction.en/vida.com.
xiii. The Terms and Conditions herein above, may be released of escinded stipulate further by Honble High Court/Official Liquidator at any time.

SalDate: 25/09/2024
Place: INDORE (M.P.)
OFFICIAL LIQUIDATOR
OFFICIAL LIQUIDATOR Date: 25/09/2024 Place: INDORE (M.P.) Phone: 0731-2710051

Prione: 0731-2710051 HIGH COURT OF MADHYA PRADESH, INDORE 1ST FLOOR, OLD CIA BUILDING, OPP. GPO, RESIDENCY AREA, INDORE (M.P.) MONOR: U731-2710U51
HIGH COURT OF MADHYA PRADESH, INDORE
1ST FLOOR, OLD CIA BUILDING, OPP. GPO, RESIDENCY AREA, INDORE (M.P.)

દૂધ ચોરીનું કૌભાંડ પકડવાની અદાવત રાખી અધિકારીના બાઈકને કોબા સર્કલ પાસે ટક્કર મારી હતી

મધર ડેરીના અધિકારીને આઈશર નીચે કચડી હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા

ગાંધીનગરના ભાટ ખાતે આવેલી મધર ડેરીમાં દૂધ ચોરીના કૌભાંડને પકડનારા અધિકારીનું અકસ્માતમાં મોત થયું હતું. પોલીસ તપાસ દરમ્યાિન નતા પેવુ હતું. તાલાત તાલા ટ્રાનનાન આ મોત માટે પડ્યંત જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું. ડેરીમાં દૂધ દિસ્પેચ ડોક ઇન્ચાર્જ અધિકારી તરીકે કામ કરતા યુવકે વર્ષ 2020માં દૂધ ચોરીના કૌભાંડનો પદકાશ કરાયો હતો. જેની અદાવત રાખી આઈસર ગાડીના માલિકે હત્યાનું કાવતરુ ઘશ્રુ હતું અને કોબા સર્કલ નજીક અધિકારી બાઈક પર જતા હતા ત્યારે આઈશરની ટક્કર મારી હતી_. ઈન્ફોસિટી પોલીસે કેસની તપાસ દરમિયાન હત્યારાની ધરપકડ

ભટ્ટે આરોપીને આજીવન કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો છે.

કેસની વિગતો મુજબ, ગાંધીનગરના સેક્ટર - I ખાતે રહેતા કનુભાઈ મોતીભાઈ પટેલનો ભત્રીજો દીપક સેક્ટર છબાભાઈ પટેલ વર્ષ - 2020 માં ભાટ છળાભાઇ પટલ પંચ - 2020 માં ભાટ ગામે સ્થિત મધર ડેરીમાં દૂધ ડિસ્પેચ ડોક ઈન્ચાર્જ અધિકારી તરીકે કરજ બજાવતો હતો. દીપકે પોતાની કરજ દરમિયાન દૂધની હેરાફેરીનાં નેટવર્કનો પદ્દાંકાશ કર્યો હતો. આ કૌભાંડ માટે જવાબદાર મહંમદ આશીફ અબ્દુલગની મેમણની ગાડીઓને મધર ડેરીએ બંધ કરાવી હતી અને ડેરીમાં તેના પ્રવેશ પર પ્રતિબંધ આવી ગયો હતો. 24 માર્ચ 2020 નાં રોજ કનુભાઈને દીપક સાથે અકસ્માતની જાણ થઈ હતી, દીપકના



મારીને નાસી ગયો હોવાનું જાણવા મળ્યુ નારાન નાસા ગયા હોયાનું જાણવા નેગ્યું હતું. કનુભાઈ સહિતના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા કરજના તબીબે ગંભીર ઈજાના પગલે દીપક પટેલને મૃત જાહેર કર્યો હતો. ઈન્ફ્રોસિટી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી ત્યારે અકસ્માતની ઘટના શંકાસ્પદ ગણાઈ હતી. દીપક પટેલે દૂધ ડિસ્પેચ ડોક ઇન્ચાર્જ

અધિકારીની ફરજ દરમ્યાન મહંમદને કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. અકસ્માતની જાણ થઈ હતી. દીપકના દૂધની ચોરી કરતા પક્રબો હતો. જેથી આ કેસમાં ગાંધીનગરના પ્રિન્સિપાલ બાઈકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મધર ડેરી દ્વારા મહંમદની આઈસર

પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમ છતાં નાખી મહંમદ અને તેનો ડ્રાઈવર નાસી 23 મી માર્ચની રાતે મહંમદ ડેરીએ ગયો ગયા હતા. આ ગુનાને અંજામ આપવા હતો. જેને અટકાવતા દીપક પટેલ સાથે તેણે આઈસરની નંબર પ્લેટ ઉપર સ્ટીકર ગાળાગાળી કરી મહંમદ ત્યાંથી નીકળી ગયો હતો. શંકાના આધારે પોલીસે મારી દીધું હતું. ઈન્ફોસિટી પોલીસે તપાસના આધારે તપાસ કરતાં હત્યાના ઈરાદે અકસ્માત

દાહોદના સિંગવડ ગામમાં પીડિત પરિવારની મલાકાતે કોંગ્રેસ અને આપના નેતા પહોંચ્યા

પ્રકરણમાં હવે રાજકારણ ગરમાવ્યં છે.

ગઈકાલે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દારા રેલી સ્વરૂપે દાહોદ એસપીને આરોપી આચાર્યને કાંસી મળે માંગ

હત્યાનો ગુનો દાખલ કરી જરૂરી આધાર પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ, આઇ. કર્યો હોવાનું બહાર આવ્યુ હતું. અકસ્માત કરનારી આઈશરના માલિક મહંમદ આશીફ અબ્દુલગની મેમણની પરપકડમાં મહત્ત્વના ખુલાસા થયા હતા. મહંમદની ચાર ગાડીઓ મધર ડેરીમાં દૂધની હેરાફેરી માટે બાંધવામાં આવેલી ભકની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જરના કાટના ચાલા જતા સરકારા પકાલ જીગ્નેશ જોશીએ ડ્રાઇવરનું CrPC કલમ- 164 નિવેદન રજૂ કરી જુબાની લેવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર દ્વારા હતી. દીપકના કારણે ચોરી પકડાઈ હોવાથી મહંમદે તેની હત્યાનું કાવતરું ઘણુ હતું. મહંમદ સાથે ઝઘડાના બીજા લેવાના આવા હતા. જેના ડ્રાઇગર કારો કેસને સમર્થન કરતી જુબાની આપવામાં આવી હતી. આ દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી મહંમદ મેમણને આજીવન દિવસે 24 માર્ચે પરોઢિયે દીપક બાઈક લઈને ઘરે જઈ રહ્યો હતો. જેનો આઈસર કેદની સજા અને રૂ. ! લાખનો દંડ ગાડીમાં પીછો કરી કોબા સર્કલ નજીક ફ્ટકાર્યો છે.

પહોંચ્યા હતા. જૈનીબેને છાત્રાની હત્યા

મામલે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યુ હતું.જેમાં ગુરુ શિષ્યના સંબંધને

કલંકિત કરનાર નરાધમ આચાર્યનો કેસ

ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે અને તેને ફાંસી મળે તે પ્રકારની કાર્યવાહી કરવાની માગ કરી હતી. જોકે બુધવારના રોજ આપના ચૈતર વસાવાએ પરિવારના

ઘરે જઇને વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી હતી.જોકે ઉપરોક્ત રાજકીય પક્ષોએ

નરાધમ આચાર્ય વિવિધ સંગઠનો સાથે

જોડાયેલો હોવાથી નેતાઓ ભેંદી મૌન સેવીને બેઠા છે તેવા પ્રકારના આક્ષેપ

કર્યા હતા.

ગાંધીનગરમાં ઘ-4 અંડરપાસમાં જાદુ વગર વરસાદે પણ પાણી ભરાયાં

ગટરના પાણી ઊભરાયાં. અસહ્ય દુર્ગંધથી હાલાકી

નવગજરાત સમય > ગાંધીનગર

≡પાટનગરને સ્માર્ટ સિટી બનાવવાના હેતથી 3.38 કરોડના ખર્ચે ઘ-4 અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. લોકાર્પણના થોડા દિવસોમાં જ પહેલા વરસાદ દરમિયાન આ અંડરપાસ જળબંબાકાર થઈ ગયો હતો. શરૂઆતના દિવસોથી જ કોઈ ને કોઈ સમસ્યાથી ઘેરાયેલો રહેતો વગર જ ખાબોચિયાં જોવા મળ્યા સર્જાયું હતું. પાણીની નજીક પહોંચ્યા હતા. અંડરપાસમાં ગટરના પાણી પછી માથું કાટી જાય તેવી અસહ્ય દુર્ગંપ ભરાઈ ગયાં હોવાથી અસહ્ય દુર્ગંધથી આવતી હતી. સહેજ ધ્યાનથી જોતાં આ વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. ઘ-4 અંડરપાસમાં પાણીના નિકાલની



સબમર્સિબલ પંપ મુકવા પડે છે. ચોમાસા છતાં કારમાં પણ દુર્ગંધ કેલાઈ જતી હતી. દરમિયાન વાહનચાલકો આ માર્ગ પરથી જેથી કારચાલકોએ અંડરપાસની બહાર પસાર થવાનું ટાળે છે. બુધવારે વરસાદ નીકળીને એર ફ્રેશનરની મદદ લેવી આ એડરપાસમાં બુધવારે વરસાદ વગર જપાણી ભરાઈ જો આશ્રર્થ પડતી હતી. આ ઉસ્સામાં વધે એક વાર વગર જ ખાભોવિયાં જોવા મળ્યા સર્જાયું હતું, પાશ્રીની નજીક પહોંચ્યા મ્યુનિ. તંત્ર ગટરના પાણી ઉલેચવાની સર્જાયું હતું. પાણીની નજીક પહોંચ્યા પછી માથું ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધ કવાયત હાથ ધરીને સમસ્યામાં કામચલાઉ રાહત અપાવી દેશે, પરંત પાણી ડહોળું હતું અને દુર્ગંધ મારતી હોવાથી ગટરનું હોવાનું નિશ્ચિત થયું રૂ.38 કરોડના ખર્ચે બનેલા આ અંડરપાસ પાછળ થયેલો તોતિંગ ખર્ચ એળે ન જાય પત્ર-પત્રસારમાં પાત્રસાર માં અના પત્રસાર ગટર છું હતાનું દાવાયા પત્ર વત્ત્રસાબપુરતી હોવાથી દરેકેવરસારમાં હતું. ઢિચલે વાહનચાલકો તો નાક અને એડ પાણી ભરાઈ જાય છે અને અંડરપાસ દબાવ્યા વગર અંડરપાસમાંથી પસાર તજવીજ બંધ કરવો પડે છે. પાણી ઉલેચવા માટે થઈ શકતા ન હતા, જ્યારે કાચ બંધ હોવા અધરું છે. અને અંડરપાસ સમસ્યામક્ત બને તેવી તજવીજ ક્યારે હાથ ધરાશે તે કહેવું

સુરતના પૂર્વ જિલ્લા લેન્ડ રેકોર્ડ ઇન્સ્પેક્ટર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ ઇન્પેક્ટ આલમસિંક જાતિક લોકાં કાયદેસની આવ રૂ.પદ્દ.૯,૧૦૨/ અપ્રમાણસર મિલક વસાવી છે, લાદમાં ની સામે પોતાના તથા પોતાના (ઉપાર) હોવાના તેમ હેલ કેલ્ડ કેલ વિભાગ તપાસ કાય પરવામાં આવી હતી. તપાસ પરિવારભોના નામે ફૂલ કોક્કળ



નોંધીને બુધવારે ધરપકડ કરી હતી. સુરત એ.સી. બી.એ સત્તાવાર

રીતે જણાવ્યુ હતું કે, માહિતી મળી હતી કે, સુરત DILR કચેરી લેન્ડ રેકોર્ડમાં વર્ગ-3ના અધિકારી રહી ચુકેલા ડિસ્ટ્રીકટ મેળવ્યા હતાં. આ આલમસિંહે પોતાની

રૂકટોપ સોલર પ્લાન્ટ્સનું સંસ્થાપન દેતર આપંત્રિત નોટીસ

(DILR) કરીડીમાં લેન્ડ રેકર્ડ ઇન્સપેક્ટર દરમ્યાન મેળવેલા દસ્તાવેજી પુરાવાઓ તરીકે કરજ બજાવીને રિટાયર્ડ થયેલા તથા બેંક ખાતાઓની વિગતો અને આલમસિંહ ચૌહાણ સામે એન્ટી કરપાન વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલી દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રીત કરી હતી. તપાસના અંતે મળેલી તમામ વિગતોની એ.સી.બી.ના નાણાકીય સલાહકાર મારફકે વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું. લેન્ડ રેકર્ડ ઇન્સપેક્ટર તરીકે આલમસિંહે પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી ઇરાદાપુર્વક વિવિધ ભ્રષ્ટ રીત-રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણા

પશ્ચિમ રેલવે – વડોદરા કિવિઝન પશ્ચિમ રેલવે – અમદાવાદ કિવિઝન

ઓનલાઈન જાફેર નિવીદા -૯૬ (૨૦૨૪-૨૫) પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનીટ, ગાધીનગર (યારોગ્ય અને પરિવાર :

અધિક્ષક ઈજનેરશ્રી, પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન યુનીટ, ૪થો માળ. પી.આઈ.યુ./ આર.ડી.ડી. / ચેન ચેચ એમ. બિલ્ડીંગ, સીવિલ ફ્રેસ્પિટલ કંમ્પાઉન્ડ, ગાંધીનગર-૩૮૨૦૧૨ ક્રોન નં (૦૭૯) ર૩૨ ૩૧૪૩૪ અને ફેક્સ નં - (૦૭૯) ૨૩૨૩૧૯૯૫ ધ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઈજારદારે યાસેથી ૨ (બે) કામો *જેની અંદાજીત કીંમત* રૂા. ૩૪.૫૯ લાખ થી

રૂ. ૬૯.૧૭ લાખથી છે. જે કામો ઓનલાઈન ઈ-ટેન્ડરીંગ પધ્યતીથી ટેન્ડર માંગવામાં આવે છે. આ કામના ના ટેન્ડરનાં દસ્તાવેજો વેબ સાઈટ www.tender.nprocure.com ઉપર તા ૨૨to-૨૦૨૪ ના ૧૮.૦૦ કલાક <mark>સુધી જોવા</mark> મળી શકશે. વધારાની વિગતો માટે ઉપર જણાવેલ વેબસાઈટ જોવા વિનંતી છે.

નોંધ ૧ - ટેન્કર ફી, ઈ.એમ.ડી. વિગેરે ઓરીજનલ ડોક્યુમેન્ટ, ઓનલાઈન રકેન કરી અપલોડ કરવાના અને ૭ (સાત) દિવસમાં આર.પી.એ.ડી. થી. મોકલવાના રફેશે.

well with venich synologie), we will complete only of the section will well with other sections of the section ્રત્યું જ માલિકી અને કલ્જલ ભોગવરાની દોવાનું જણા કહેલું છે અને અમારા અસીરી સરાફ જાના પ્રત્યેના લેપાનું જણા માંકેટલલ દોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કો ભારતનો કોઇપણ પ્રકારનો લાગભાગ, ફક્ક, ફિલ્ત, ફિસ્સો, દાવો દહેશી દિન — (સાવ)માં અમોને તે બદલના પુરાણા અમે-સ્ટાના કેસ્ટ્રાની, ગો તેમ કરવામાં —"

Glory - 11, Off S G Highway, Ahmedabad-382470

ਪશ્ચિમ ਵੇલવે - અમદાવાદ ાવારક જાળવણી અને સમારકામના કામો

મનો ફોલી કરો: 🔀 twitter.com/WesternRly અમને ફોલી કરો: 🔀 twitter.com/WesternRly

રૂ.૭૩,૩૩,૬૫૮/- વધુ સપંતિ વસાવી હોવાનું જણાયુ હતું. એ જોતા તેમની આવકના પ્રમાણમાં ૧૨૮.૭૫% થી વધુ અપ્રમાણસર મિલ્કતો છે. એવું જણાતા પ્રાથમિક તપાસ કરનાર પોલીસ ઇન્સપેક્ટર બી.ડી.રાઠવાએ સરકાર તરફે

અને ખર્ચ રૂ.૧,૩૦,૯૯,૨૮૨/- કર્યો હોવાનું તપાસમાં જણાયુ હતું. એટલે તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં ફરિયાદ આપી સુરત એસીબી પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું. જયારે આજે 6 વર્ષની માસુમ બાળકી ગુમાવનારા પરિવારને સાંત્વના આપવા માટે હવે રાજકીય પક્ષના આપવા માટ હવે રાજકાય પક્ષના નેતાઓ જઇ રહ્યા છે. જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહિલા મોર્ચાના પ્રમુખ જૈનીબેન દુંમ્મરે પીડિત પરિવારની મુલાકાતે

	E-Tender Cum Reverse A	uction Not	ice
E-Tender ID	Description	E-Tender Live Date	Last Date for Online Submission
111796	Minerals Chelated and Non Chelated for Cattle Feed Plant, Jagudan.	26/09/2024	04/10/2024
109501	Sale of Scrap Jute Bags and Woven/Plastic Bags at Cattle Feed Plants, Ubkhal and Jagudan.	26/09/2024	08/10/2024

For details refer render document available on e-lender website. We regularl publish e-tender on above website.

Date: 26.09.2024 I/C Managing Director

જાહિર નોસ્ટિક આપી જલાવાનું કે, પ્રિફિક્ટ હહેદાર સમ-દાક્રિકિટ હેકર ના મોર્જ ગામ - વેજ્યુરની સીમના માતા નંબર - ૪૩૬ જેનો કર્ય નંબર - ૩૯૬/૧૯/૧ જે છે. અદેર મો/ ડે. ૨૯૦-૪૦ કે માર્ચ કર્યા કર્યા માર્ચ માર્ચ માર્ચ કર્યા કર

ર સંજ**ય એ. ઠાકોર** (બી.એ.એલ.એલ.બી. એડવોકેટ) ૧૯/૨૦૨૪ જી/એક-૧, શિવાલીક પ્લાઝા, નવિન મામલતદાર કેચરી પાસે, વિજાપુર.૩૮૨૮૭૦ મો.નં.૯૭૨૪૪ ૭૫૭૭૫

સર્વોદય કોમર્શિયલ કો.ઓપરેટીવ બેન્ક લિ., મहેસાણા હેડ ઓફીસ : સર્વોદય બેન્ક રોડ, ભમરીયા નાળા નષ્ઠક, મહેસાણા ૩૮૪૦૦૨ Email : info@sccbank.in, ફોન્ન : 02762 - 252224, Web : www.sccbank.in

ખાંતેદારો માટે અગત્યાની સુચના આ નોટીસથી બૈકના ગ્રાહકોને જ્જ્ઞાવવાનુ કે RBI ની માર્ગદાશિક મુજલ દરેક ગ્રાહકાના ખાતામાં KVC નોર્મલનું પાલન કરવું કરજાવના છે. જે ગ્રાહકોના ખાતાઓમાં KVC નોર્મલનું પાલન ઘપેલ નદી હોય તેવા ખાતાના વ્યવસારી લેક હારા અભીત કરતામાં આવ્યા છે. જે ગ્રાહકના ખાતામાં KVC કરવાવના માંદ્રી હોય તે તેવા ગ્રાહકોએ તેમના ખાતાનું KVC કરવીની ખાતુ નિયમિત કરવાવાનું કહેશે. RBI ની માર્ગદર્શીકા મુજબ જે ગ્રાહકના ખાતામાં C-KYC કરવાવાનું ભાકી હોય તે ગ્રાહકોએ નજીકની શાખાનો સર્પક કરીને તેમનું C-KYC કરવાવો લેવું. RBI ની માર્ગદર્શીકા મુજબ દેક શાહકે તેનાનો પ્રોકાઈલ નીવપિત સમ્પવંત અપડેટ કરવાવવો જરૂરી છે. ગ્રાહકોએ તેમનું તર-KYC કરવાવો ભાકી હોય તો નાજીની શાખાનો સંપર્ક કરી આખનુ Rc-KYC કરવાવી ભાકો હોય તો નાજીની શાખાનો સંપર્ક કરી આખનુ Rc-KYC કરવાવી ભાકો અને તોના કાલીક આપની શાખાનો સ્વાક લઈને નવો શોકર એક્રીમેન્ટ કરવાનો ભાકી હોય તેઓમેન્ટ કરવો કરજાયાત પાત્રખની મુકકાલ લઈને નવો શોકર એક્રીમેન્ટ કરવાવી લેવો. સ્વા' મહેસાશા ઘર્મ્સને પ્રોક્ષ સ્વા' મહેસાશ (જનરહ્ય મેનેજર)

9.0	સાંગાવદા આમાગત કરતા સાસવ્ય કૃષ્યના ૧. ભારતના રાષ્ટ્રપતિ વતી, નીચેના કામ માટે ઇ-નિવિદ્ય માધ્યમથી ઓનલાઇન આઇટમ રેટ નિવિદ્યઓ મંત્રાવવામાં આવે છે.						
s,:i	કામલું લામ	निविध गारे निर्धारित संध्यात रहम (१)	કામ પૂર્ણ કરવાનો સમયગાળો	निविद्य हस्तावेष डाઉनलोड डरवानो समयगाणो	निविद्य स्वीडारवानी छेस्ती तारीज तथा समय	निविद्य जोतवानी नियत तारीज तथा सभय	બાનાની રકમ (ઇ.એમ.ડી.) (₹)
	सैंड डेम्पस, अमहावाहनानी लवन संज्या नं. २३ ना आगण अने पाछण ना प्रवेश क्षेत्र नु नवीनीडरए अने विस्तरए - सिविस तथा पीओयना	GIVI	O૮ મહિલા	२५.०६.२०२४ वा १०:०० डवाडथी ०७. १०.२०२४ वा १७:०० डवाड सुधी	૧૫,૧૦.૨૦૨૪ ના ૧૭:૦૦ કલાક સુધી	૧૬.૧૦.૨૦૨૪ ના ૧૫:૦૦ કલાકે (ટેકનીકલ તથા કોમર્સીઅલ બોલી)	

SAÑ . Gibbl teadu's Gibblabasial ani aitual ara Gibbl ulsan ages all asault shà documbe were anatarestazat com/1880 पी Gibblabasial ani aitual ara Gibblabasia ani documbe ve unifica secuni anida is. Gibblabasia ani documbe ve unifica secuni anida is. Gibblabasia anida anida

કઠલાલની નવ પ્રતિષ્ઠીત વ્યક્તિઓ પાસેથી ખંડણી માગતા નનામા પત્રથી ખળભળાટ

કઠલાલમાં જાણિતા વેપારીઓ હોટલના માલિક ફાયનાન્સની ઓફિસવાળા મળી કુલ નવ વ્યક્તિઓને અજાણ્યા ઇસમે નનામી પત્રો લખી પૈસાની માંગણી કરી જો પૈસા નહીં આપે પટેલ, સુભાષભાઇ મણીભાઇ પટેલ, ધમકી આપી છે. અથવા કોઇને જાણ કરે તો તેઓના પરિવારને મારી નાંખવાની ધમકી ભર્યા

પત્રો મોકલતા કઠલાલના વેપારીઓમાં સનસનાટી મચી જવા પામી છે. કઠલાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કઠલાલમાં પેટ્રોલપંપ ધરાવતા



GJ1992PLC017460, ફોનઃ +૯૧ ૨૭૬૪ ૨૩૨૬ ors@arfin.co.in. વેબસાઈટ: www.arfin.co શકારને ઇક્વિટી શેરનું ટ્રાન્સફર એજ્યુકેશન એલ્ડ પ્રોટેક્શન ફંડ (આઇ ઇ પી એફ)

થોને આથી જાણ કરવામાં આવે છે કે કંપની અધિનિયમ, સ્વવર અને આઇ ઇ પી એ; શ્ર્મો, સ્વવર, ની દલાત્ર વરષ્ટ મુજબ, ડેપનીના વિદેશી શેરો, જેના સંબંધમાં ડિવિડન્ડ ત્યાર સ્વાર સાંગ્રે તાલ પહેં કે તેથી ચાલુ સ્વાયથી દાવ ધ્યારના અથવા અવેલન હતા કે તે તો ભારત સરકારના રોકાલકાર શિક્ષણ અને સંરક્ષણ ભંડોળ (આઇ ઇ પી એફ) મ ત્યજી કરવાની જરૂર છે.

માજીદઅલી અજુલમીધા ખોખરને કઠલાલ ચોકડી ખાતે આવેલ ડી.કે. પત્રો મળ્યો હતો તેમાં રોયલ કપડાના મોલ્સના માલિક દિલીપભાઇ, શોરૂમના વેપારી વિશાલભાઇ પંજાળી, કઠલાલના પ્રશાંતભાઇ ઠાકર, ઇરફાન કઠલાલ સ્વાગત હોટલના માલીક ઇક્લાલભાઇ વોરા, કઠલાલ સોની કેતનભાઇકનૈયાલાલ પટેલ, ફાઇનાન્સ બજારમાં આવેલ જવેલર્સના વેપારી ઓફિસવળા, શંકરભાઇ સુભાષભાઇ વિનુભાઇ ચોક્સી સહિતના નામ લખી



AHMEDABAD MUNICIPAL CORPORATION MAHANAGAR SEVA SADAN **Pubic Health Laborator** Short E-Tender NO: 02/2024-25

Short E-Tender No: 02/2024-25: Short e-Tender for Provide Skilled & Unskilled Manpower for Laboratory work to the Public Health Laboratory of Ahmedabad Municipal

Corporation.	
Online Tender Submission:	07/10/2024, Up to 6:00 Hrs.
Technical Bid Physical Submission:	08/10/2024, Up to 4:00 PM
Technical Bid Opening:	08/10/2024, Up to 5:00 PM
Details and Tender Available on	https://amc.nprocure.com

AMDAVAD MUNICIPAL CORPORATION

Sr. No.	Name of Work	Estimated amount in Rs. Lacs
1	Augmentation of Saraspur Shardaben Water Distribution station in Saraspur-Rakiyal Ward North Zone.	1950.35
2	Augmentation of Fatehpura Water Distribution station in Paldi ward, west zone of AMC (Phase-II)	449.78
3	Augmentation of New Sabarban water Distribution station in Baherampura ward, South Zone of AMC.	1769.47
4	Construction Overhead tank at Shahidvan water Distribution Station in Vasna ward West Zone of AMC.	455.10
5	Construction Water Distribution Station in TP- 26, Final Plot No. 393/1 in Vasna Ward of West Zone.	1644.76
	Online Tender submission Date & Time	Dt. 17/10/2024 Up to 18:00 hrs

એસેટ રીકવરી ડિપાર્ટમેન્ટ

ਪਲੇशਰ ਗੇਣੀસ

oi.	ઉધારકર્તાઓ/ જામીનદારોનું નામ / શાખાનું નામ	ડીમાન્ડ નોટીસની તારીખ / બાકી લ્હેશા (રૂા.)	સ્થાવર મુકેલ મિલકતનું વર્ષન	પઝેશનની લારીખ/ પ્રકાર
9	શ્રીમતી કોઉલાબેન શૈલેશ રાવત અને શ્રી શૈલેશ બાબુભાઇ રાવત શાખા: જેતલપુર	૧૪.૦૫.૨૦૨૩ રૂા. ૮,૦૧,૧૦૮.૨૬/- (રૂા. આઠ લાખ ઇકોતેર હજાર એક્સો ઇઠ્યોતેર અને છબ્લીસ પૈસા ફક્ત) ચડત વ્યાજ સાથે	श्रावाद शिवात कोरते में जिन्नभेतीवाताक पणील पार सकेत शिकिनांचुं गांधाका पारीक नं. कर (भी), तिम्मान्त्र ना. च.च. कुत मोनान्त्र मोनान्त्र गांधाका पार्टम कर पार को सीची हात आहे आहे हात्र ता. माशाक मोनीपुर (वेदानी तं द आप पंचाबत, ता. भारता, किसी, अंबोरीनार पारी गांधीव राष्ट्रा विकाद भी मोनांच्या (चिटा देहें , दिखी की किसी माशामार्थ परेतन् चार, पूरी तिमानु माशामा रोठ, पश्चित रोठ जात तेनामार्थ जीना, परेतानुं चार,	૨૦.૦૯.૨૦૨૪ સાંકેતિક કબજો
5	श्रीमती शर्दुतवा रामजरेश दिवादर उपने श्री रादुव रामजरेश दोठी राजाः अमहावाह भेर्वन	৭5.০६.২০২3 হা. ৭૫,७६,८४७.४८/- (হা. এটে রোপ স্ঠাগায়গুরী গুন্দর আঙ্কা যুক্তরাগৌম স্ফল অঙ্গরাগীয় শুমা কুরন) যাহর যোগ মার্থ	સમાર વિલાકત કરીદ તો. એમખ, પાંચમે આવા (એએએમી હારા મેળૂડ પાના ખાત્રો હોયો માળ) (જિલ્લાઓ પીલા) મુંદ્રેના પાત્ર તકે તો.એક. ખાતના હાર્યું તે માં ભાગીલી હોયો અને અભિગ્રજી લાગેલાંમાં લાગ સાથે એમના એમેનિટીસ તોખ્યત કરૂર છે. મોદર વેખોન આપેલ તર્વે તે, નવક + બલ્લા કો પ્લસ્તા/મૃત્યું કહ્યું હોયો ક્લાંમાં તે હાલ કેવા ના વાર કર્યું તે હોયો કર્યા કરાય કર્યા	રર.૦૯.૨૦૨૪ પ્રત્યકા કબજો
3	મેસર્સ એન ઇગલ ઇન્ડસ્ટ્રીઝ વર્તી તેના ભાગીદારો ૧. શ્રી મેલિક પ્રદિપ શાહ અને ૨. શ્રીમતી સ્મિતાએન પ્રદિપ શાહ શાખાઃ રિલીફ રોડ	૧૨.૦૧.૨૦૨૪ રૂા. ૧,૫૫,૯૮,૫૩૯.૩૨/- (રૂા. એક કરોડ પંચાલન લાખ અલભું હત્તર પાંચસો ઓગણચાળીસ અને બગીસ પૈસા ફક્ત) ચડત વ્યાજ સાલે	એમને એમ તો કાંગલના, ભાગીદાદી પ્રીપ્ત, બ્લી તેવના ભાગીદાદી ગે. શો નીકાર પ્રદિપ માત્ર હતો ન . સીમાં કિલ્લાને મહિલ માત્રવાના નાને સ્થાપાર દિલાઈને કાન્દ્રને સાથે તો માં કર, બોર સે લીકારો સેન્ડાલ તેવના પ્રત્યું લાંકામ તૃત હો એમાં આ માત્ર તો કાંગ્યું કરે કોંગ્રેસ કરો મોટલે તો તો તો માત્રવાના કાંગ્યું લાંકામ તૃત હો એમાં આ પોતાને કાંગ્યું કરો કાંગ્યું કરો કોંગ્યું કરો કરો કોંગ્યું કરો કરો કોંગ્યું કરો કોંગ્યું કરો	રર.૦૮.૨૦૨૪ પ્રત્યકા કબજો
8	મેરુર્સ એસીઈ એન્ટરપ્રાઈસીઝ વતી તેના પ્રોપ્રાઈટર ૧. શ્રીમતી ગુલનાઝ સલીમ લાહોરી શાખા: અમદાવાદ રિક્વરી શાખા	૦૧.૧૧.૨૦૨૩ રૂા. ૯૦,૯૦,૧૨૦.૫૨/- (રૂા. નેવું લાખ નેવું હજાર એક્સો વીસ અને બાવન પૈસા ફ્ક્ત) ચડત વ્યાજ સાથે	શ્રીમતી ગુલનાઝ સ્ત્રીમ લાકોરોની માલિલીની ફેક્ટરી જમીન અને નિલિટન રામાવેથી મિલકત પહેર નં. ડરાનલુપોલિંદ કોઝલ, પાંચ ત્યાં કરો હતું. લુગન પાર્ક, કોકા કંપની પારે, સાહાંદ સુઆવંડીથી, ફેઝન્સ, મોર્ગ - હિરાસુ, તાલુકા – સાહાંદ, અમદાવાદ, ગુજરાત – ૩૮૨૪૪૫ ખાતે આવેલ સમગ્ર મિલકત જેમે વર્તું સોમાઃ પૂર્વઃ પ્લોટ નાં. ૯૮, પશ્ચિમેક ૩૫૦ મોટર પહોળુ વૂ.સી. અને ૧૨,૦૦ મીટર ટોક, ઉત્તરે: પહોર નાં. ડરાનલુપોલિંદ, કહિલોય: ૧૦ અમિટર પહોળુ વૂ.સી. અને ૧૨,૦૦ મીટર ચોક.	રર.૦૯.૨૦૨૪ પ્રત્યકા કબજો



ARFIN INDIA LIMITED

Registered & Corporate Office: Plot No.117, Ravi Industrial Estate, Behind Prestige Hotel, Billeshwarpura, Chhatral, Gandhinagar-382729, Gujarat, India.

CIN: L65990GJ1992PLC017460, **Tel. No.:** +91 02764 232621, **Fax:** +91 02764 232620

Email: investors@arfin.co.in, cs@arfin.co.in Website: www.arfin.co.in

Name - Date : 25/09/2024

Address – Ref. No. :

Folio No./DP-CLID: Equity Shares:

Dear Shareholders,

Subject: Transfer of shares in respect of which dividend has not been claimed for seven consecutive years or more to the Investor Education and Protection Fund

This is to inform you that pursuant to the provisions of section 124(6) of the Companies Act, 2013 and the Investor Education and Protection Fund Authority (Accounting, Auditing, Transfer and Refund) Rules, 2016, which have come into effect from September 7, 2016, stipulates that shares on which dividend has not been encashed or claimed for seven consecutive years or more, then such shares are to be transferred to the Investor Education and Protection Fund (IEPF), a fund constituted by the Government of India under section 125 of the Companies Act, 2013.

It has been noticed that you have not encashed the dividend warrants for last seven consecutive years commencing from the unpaid final dividend for the year 2016-17 on the equity shares held by you. The details of dividend amount not claimed by you are as under:

Dividend for the year	Warrant No.	Amount (Rs.)
Final dividend for the year 2016-2017		
Final dividend for the year 2017-2018		

To claim above unpaid dividend or in case you need any information / clarification, please write to us or contact our RTA, MCS SHARE TRANSFER AGENT LIMITED at 101, Shatdal Complex, Opp: Bata Show Room, Ashram Road, Ahmedabad -380009, Gujarat, India, Tel No.: + (079) - 26580461 / 62 / 63, e-mail: mcsstaahmd@gmail.com. Please provide following details in all your communications: 1. Name of the company, 2. Folio no. or DP and Client ID, 3. Name of shareholder, 4. Contact no., 5. Email ID. Also provide self-attested KYC documents of the shareholder like PAN, cancelled cheque leaf along with latest utility bill as address proof.

You are requested to claim unpaid dividend on or before 17 October, 2024, failing which the above said shares will be transferred to IEPF at appropriate date. After the shares have been transferred to IEPF, you can claim the said shares from IEPF authorities, by filing e-form no. IEPF-5, as prescribed under the said rules. Please note that no claim shall lie against the company in respect of unclaimed dividend and equity shares transferred to the IEPF.

Thanking you, Yours faithfully,

For Arfin India Limited Sd/-Mahendra R. Shah Chairman DIN:00182746

^{*}This is computer generated letter & does not require signature.